

SARDAR PATEL UNIVERSITY
B Com (V - Semester) Examination
Friday, 12th April, 2019
10.00 am - 12.00 pm
UB05CCOM10 - Financial Management

Total Marks : 60

Notes: Figures to the right indicate marks.

- Q.1 Define Financial Management and discuss in detail Managerial Finance functions and routine finance functions. (15)

OR

- Q.1
- (a) Explain the importance of Financial Management. (07)
- (b) Explain in brief Profit Maximisation and Wealth Maximisation objectives of Financial Management. (08)

- Q.2
- (a) What do you understand by Financial Planning ? Discuss the factors affecting Financial Planning. (11)
- (b) Explain the Limitations of Financial Planning. (04)

OR

- Q.2 What is Over-capitalisation ? Discuss its causes, effects and remedies. (15)
- Q.3 Explain the following sources as a long term source of finance. (15)
- (a) Equity Share (b) Debenture

OR

- Q.3 Explain the following sources of Finance. (15)
- (a) Internal Financing (b) Foreign Capital
- (c) Public Deposits

- Q.4
- (a) What is Capital Budgeting ? Explain the significance of Capital Budgeting. (08)
- (b) Explain in brief types of Capital Budgeting decisions. (07)

OR

(P.T.O)

Q.4 X Company is examining two mutually exclusive proposals for new capital investment. The data on the proposals are as follows:

(15)

	Proposal 'A'	Proposal 'B'
Capital Investment	Rs. 880000	Rs. 1100000
Salvage Value	Rs. 80000	Rs. 100000
Estimated Life	4 years	5 years
Depreciation	Straight line method	Straight line method
Rate of Income tax	50%	50%
Cost of Capital	10%	10%
Earnings before depreciation & tax:		
1st year	Rs. 240000	Rs. 280000
2nd year	Rs. 280000	Rs. 320000
3rd year	Rs. 320000	Rs. 360000
4th year	Rs. 440000	Rs. 440000
5th year	-	Rs. 400000

Using:

- (a) Pay-back period Method
- (b) Average Rate of Return Method and
- (c) Net Present Value Method Calculations, you are asked to advise which proposal would be financially preferable ?

The discounting factors @ 10% are as follows :

0.909, 0.826, 0.751, 0.683 and 0.621

[8-G] Seat No: _____

SARDAR PATEL UNIVERSITY
B Com (V - Semester) Examination
Friday, 12th April, 2019
10.00 am - 12.00 pm
UB05CCOM10 - Financial Management

કુલ ગુણ : ૭૦

નોંધ: જમણી બાજુના આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

પ્ર.૧ નાણાંકીય સંચાલનની વ્યાખ્યા આપો અને સંચાલકીય નાણાં કાર્યો અને રૂઢિગત નાણાં કાર્યોની ચર્ચા કરો. (૧૫)

અથવા

પ્ર.૧
(અ) નાણાંકીય સંચાલનનું મહત્વ સમજાવો. (૦૭)
(બ) નાણાંકીય સંચાલનના 'નફાનું મહત્તમીકરણ' અને 'સંપત્તિનું મહત્તમીકરણ' ઉદ્દેશો ટૂંકમાં સમજાવો. (૦૮)

પ્ર.૨
(અ) નાણાંકીય આયોજન એટલે શું ? નાણાંકીય આયોજનને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો. (૧૧)
(બ) નાણાંકીય આયોજનની મર્યાદાઓ સમજાવો. (૦૪)

અથવા

પ્ર.૨ અતિમૂડીકરણ એટલે શું ? તેના કારણો, અસરો અને ઉપાયોની ચર્ચા કરો. (૧૫)

પ્ર.૩ લાંબા ગાળાના નાણાં પ્રાપ્તિના સાધન તરીકે નીચેના સ્ત્રોતો સમજાવો. (૧૫)
(અ) ઈક્વિટી શેર (બ) ડિબેન્ચર

અથવા

પ્ર.૩ નાણાં પ્રાપ્તિના નીચેના સ્ત્રોતો સમજાવો. (૧૫)
(અ) નાણાં પ્રાપ્તિના આંતરિક સાધનો (બ) વિદેશી મૂડી (ક) જાહેર થાપણો

પ્ર.૪
(અ) મૂડી અંદાજપત્ર એટલે શું ? મૂડી અંદાજપત્રની અગત્યતા સમજાવો. (૦૮)
(બ) મૂડી અંદાજપત્ર નિર્ણયોના પ્રકારો ટૂંકમાં સમજાવો. (૦૭)

અથવા

(P.T.O.)

૫.૪ એક્સ લિમિટેડ તેની નવી મૂડી રોકાણ યોજના માટે બે પરસ્પર નિવારક દરખાસ્તો તપાસી રહી છે. આ દરખાસ્તો અંગેની માહિતી નીચે મુજબ છે :

(૧૫)

	દરખાસ્ત 'અ'	દરખાસ્ત 'બ'
મૂડી રોકાણ	રૂ. ૮૮૦૦૦૦	રૂ. ૧૧૦૦૦૦૦
ભંગાર કિંમત	રૂ. ૮૦૦૦૦	રૂ. ૧૦૦૦૦૦
અંદાજી આયુષ્ય	૪ વર્ષ	૫ વર્ષ
ઘસારો	સીધી લીટીની પદ્ધતિ	સીધી લીટીની પદ્ધતિ
આવકવેરાનો દર	૫૦%	૫૦%
મૂડી પડતરનો દર	૧૦%	૧૦%
ઘસારો અને કરવેરા પહેલાંની કમાણી :		
૧ લા વર્ષે	રૂ. ૨૪૦૦૦૦	રૂ. ૨૮૦૦૦૦
૨ જા વર્ષે	રૂ. ૨૮૦૦૦૦	રૂ. ૩૨૦૦૦૦
૩ જા વર્ષે	રૂ. ૩૨૦૦૦૦	રૂ. ૩૬૦૦૦૦
૪ થા વર્ષે	રૂ. ૪૪૦૦૦૦	રૂ. ૪૪૦૦૦૦
૫ મા વર્ષે	-	રૂ. ૪૦૦૦૦૦

તમે:

- (અ) પરત-આપ મુદત પદ્ધતિ
- (બ) સરેરાશ વળતરના દરની પદ્ધતિ અને
- (ક) યોજના વર્તમાન મૂલ્યની પદ્ધતિની ગણતરીને આધારે નાણાંકીય રીતે કઈ દરખાસ્ત અંગે સલાહ આપશો ?

૧૦%ના દરે વટાવ અવયવ નીચે મુજબ છે:

૦.૯૦૯, ૦.૮૨૬, ૦.૭૫૧, ૦.૬૮૩ અને ૦.૬૨૧